

મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો.

પંચમહાલ,દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લાના મુખ્ય પાક એવા મકાઈ પાકના વધુ ઉત્પાદન માટે તેમજ મકાઈ પાકની ખેતી પદ્ધતિની આધુનિક તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચે એ હેતુસર સદગુરૂ ફાઉન્ડેશન, ચોસલા, જિ-દાહોદ દ્વારા અત્રેના કેન્દ્ર ખાતે દાહોદ જીલ્લાના જુદા- જુદા તાલુકાના ખેડૂત ભાઈઓ તેમજ બહેનો માટે તા.૧૨,૧૭,૧૯ અને ૨૦ માર્ચ, ૨૦૧૮ ના રોજ એક- દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.

મકાઈની આધુનિક તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચે તેમજ મકાઈની વિવિધ સંયોજિત, સંકર અને મુલ્યવર્ધિત જાતો અપનાવે એ હેતુસર કરવામાં આવેલ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવેલ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. એમ.બી.પટેલ કેન્દ્રના વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા વધુ ઉત્પાદન આપતી રાજ્યની આબોહવામાં અનુકૂલિત મુલ્યવર્ધિત મકાઈની જાતો અને ખાસિયતો વિષે માહિતગાર કર્યા હતા. ડૉ. પી.કે.પરમાર , મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (પ્લાન્ટ બ્રીડર) દ્વારા મકાઈની વિવિધ સંકર અને સંયોજિત જાતોની બીજ ઉત્પાદન વૃદ્ધિ કાર્યક્રમની તાંત્રિકતા વિષે સંપૂર્ણ માહિતી આપેલ હતી. પ્રો.કે.એચ.પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એગ્રોનોમી) દ્વારા મકાઈમાં આધુનિક ખેતી પદ્ધતિ વિષે તેમજ નિંદામણ નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા અંગે સચોટ માહિતી આપેલ હતી. ડૉ.એસ.કે.સિંઘ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (પ્લા.પેથો) દ્વારા મકાઈ પાકમાં આવતા રોગોના નિયંત્રણ વિષે તેમજ મકાઈમાં આવતી જીવાતો અને તેના નિયંત્રણ ઉપાયો વિષે જાણકારી આપી.

પ્રો.ડી.એમ.રાહોડ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (વિસ્તરણ) દ્વારા ખેડૂતમિત્રોને જૈવિક ખાતરની મકાઈપાકમાં અગત્યતા વિષે તેમજ રાસાયણીક ખાતરનો વપરાશ ઘટાડવા અંગે અને જૈવિક ખાતરનો વપરાશ કરવા પર ભાર મુક્યો હતો. ડૉ.બી.એન.ઠક્કર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (વિસ્તરણ) દ્વારા મકાઈપાકમાં પ્રથમ હરોળના નિદર્શનો તેની કાર્યપદ્ધતિ અને ફલશ્રુતિ વિષે માહિતી આપેલ હતી. ખેડૂતમિત્રોને એકઝીબીઝન હોલ અને ખેતરની મુલાકાત પણ કરાવવામાં આવેલ હતી.



મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા ખાતે તાલીમ કાર્યક્રમ